

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૬/૧૨/૨૦૧૬ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

શહેર પોલીસ ધ્વારા કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી:-

સમાચાર યાદી નં.૨૩૨૬/૧૬

ચોરીના મોબાઇલ ફોનો સાથે બે ઇસમોને ઝડપી પાડતી કાઇમ બ્રાન્ચ

અમદાવાદ શહેર કાઇમ બ્રાન્ચનાં સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી જે.કે.ભટ્ટ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી રાહુલ પટેલ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં બનતાં લુટ ધાડનાં મિલકત સંબંધી તથા મોબાઇલ ચોરીના ગુન્હાઓને શોધી કાઢવા સારૂ તથા અટકાવવા સારૂ, તેમજ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સારૂ કાઇમ બ્રાંચના અધિકારીઓને સુચના આપેલ. જે અનુસધાને કાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.બારડ, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.દેસાઇ તથા સ્ટાફનાં માણસો સાથે અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે, જશોદાનગર બ્રિજ પાસેથી આરોપી નિખીલ ડ/૦ દિનેશભાઇ સબુરભાઇ રાજપુત ઉ.વ.૨૬ રહે. ગામ:- વિરોલ, રામજી મંદિર પાસે, તા.મહેમદાવાદ જી.ખેડા નાને ચોરીના એક લીનોવો કંપનીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડેલ છે. તેમજ સરખેજ સોનલ સિનેમા ત્રણ રસ્તા પાસેથી આરોપી શાહરુખ ડ/૦ અમીરુદીન કમરુદીન શેખ ઉ.વ.૨૧ રહે. અકબરભાઇ ના ડુપ્લેક્ષમાં મ.નં.૮, શમા સ્કુલ સામે, અંબર ટાવર સામે, ૧૦૦ ફુટ રીંગરોડ, કેનાલ પાસે સરખેજ C/૦ મ.નં.૯૨ કશબા પાર્ક, બાગે બદર, કેનાલ પાસે, ૧૦૦ ફુટ રિંગ રોડ, અંબર ટાવર સામે, સરખેજ અમદાવાદ શહેર નાને ચોરીના એક સેમસંગ કંપનીના મોબાઇલ ફોન સાથે ઝડપી પાડેલ છે.

આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી નં.(૧) ની પુછપરછ કરતાં પોતે પંદરેક દિવસ પહેલા મહેમદાવાદ રેલ્વે સ્ટેશન એ.ટી.એમ.માં પૈસા કાઢવા ગયેલ જ્યાં એક ૩૦ થી ૩૫ ના આશરાનો યુવક આવેલ અને પોતાને સસ્તામાં મોબાઇલ ફોન વેચવાનો છે તેમ કહી ફોન બતાવતા તેની પાસેથી મોબાઇલ ફોન ખરીદી લીધેલ જ્યારે આરોપી નં.(૨) ની પુછપરછ કરતા એકાદ મહિના પહેલા શાહઆલમ દરગાહ ગયેલ જ્યાં એક સુરત ખાતે રહેતો ઇસમ પોતાને પૈસાની જરૂર હોય સસ્તામા મોબાઇલ ફોન વેચવાનો હોવાનું કહેતા પોતે ચોરીનો મોબાઇલ ખરીદી લીધેલ અને ઉપયોગ કરતો હતો અને આજરોજ આરોપીનં(૧) ને જશોદાનગર બ્રિજ પાસેથી તથા આરોપી નં.(૨) ને સોનલ સિનેમા ત્રણ રસ્તા પાસે થી ઝડપી લીધેલ છે અને સદરી બાબતે ખાત્રી કરતા મણિનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૪૦/૨૦૧૬ ઇ.પી.કો. કલમ: ૩૭૯, ૪૨૭ તથા કાલુપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૮૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ:૩૭૯, ૧૧૪ મુજબના અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે તેમજ પકડાયેલ આરોપીઓને મણિનગર તથા કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.